

M.Com Semester - 3 (CBCS) Examination**DEC/JAN. - 2020 - [NEW COURSE]****Theory of Banking and Insurance(Elective (New))****Time: 1:30 Hours****Marks: 42****Instructions:**

1. Figure to the right indicate marks.
2. There are five questions in the question paper.
3. Answer any three of the following questions.

-
- પ્રશ્ન.૧ સગીરનાં નામે ખાતું ખોલતી વખતે સામાન્ય રીતે બેંકરે શું સાવચેતી રાખવી જોઈએ?. (૧૪)
- પ્રશ્ન.૨ ચેકને યોગ્ય રીતે દોરવા પર નિબંધ લખો. (૧૪)
- પ્રશ્ન.૩ વિમામાં અટમોસ્ફ ગ્રૂડફેથનાં સિદ્ધાંતની ચર્ચા કરો. (૧૪)
- પ્રશ્ન.૪ ફાયર ઇન્સ્યુરન્સ પોલિસી પર નિબંધ લખો. (૧૪)
- પ્રશ્ન.૫ નીચેના પ્રશ્નોના જવાબ આપો. (કોઈપણ બે) (૧૪)
1. કોઈ બેંકર તેના ગ્રાહકના ખાતાની ગુપ્તતા જાળવવા માટે બંધાયેલો છે? સમજાવો.
 2. વારાઘાટોવાળા સાધન દ્વારા તમે શું સમજો છો? તેની સુવિધાઓ શું છે?
 3. વ્યક્તિગત દ્રષ્ટિકોણથી વીમાના મહત્વનું વર્ણન કરો.
 4. ઇન્સ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનાં ઉદ્દેશો શું છે?

ENGLISH VERSION

- Q.1 What precautions should a banker generally take while opening an account in the name of a minor? (14)
- Q.2 Write an essay on proper drawing of a cheque. (14)
- Q.3 Discuss principle of utmost good faith in insurance. (14)
- Q.4 Write an essay on Fire Insurance Policies. (14)
- Q.5 Write answer of following questions. (any two) (14)
1. Is a banker obliged to maintain the secrecy of his customer's account? Explain.
 2. What do you understand by a negotiable instrument? What are its features?
 3. Describe the significance of insurance from individual point of view.
 4. What are the objective of Insurance Regulatory and Development Authority of India?
